

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૩/૦૫/૨૦૧૬ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૫૩/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૧ કેસ કરી, ૧૩ વ્યક્તિઓને ઝડપી, ૧૦૦ લીટર દેશી દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગારધારા હેઠળ ૧ કેસ કરી ૬ વ્યક્તિઓને ઝડપી, રોકડ રૂપિયા ૩૪૨૦/- અને જુગારનાં સાધનો કબજે કર્યાં હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૫૪/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૦૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૬ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

સોનાની કંઠી ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૯૫૫/૧૬

સાબરમતી : કમળાબહેન અંબાલાલ પટેલ (રહે, તીરૂપતી સોસાયટી, જી.એસ.ટી. રોડ, ન્યુ રાણીપ, સાબરમતી) તા.૨૨/૫/૧૬ ના કલાક ૧૧/૦૦ વાગ્યાના સુમારે ઘર નજીકથી પોતાના પતિ સાથે એક્ટીવા ઉપર પાછળ બેસી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ કમળાબહેનના ગળામાંથી સોનાની કંઠી કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ કમળાબહેન પટેલે સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી કે.એમ.છાસીયા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૯૫૬/૧૬

ચાંદખેડા: રાધાબહેન રવિલાલારામ વર્મા (ઉ.વ.૨૪)(રહે.લક્ષ્મીનગર, નર્સરી, મોટેરા ચાંદખેડા) ના બાળકો મસ્તી-તોફાન કરતા હોઈ રાધાબહેન બાળકોને મારતા હોઈ રાધાબહેનની બહેને બાળકોને કેમ મારે છે તેમ કહેતા મનમાં લાગી આવતાં, તા.૨૨/૫/૧૬ નાં કલાક ૧૦/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે છતની પાછપ સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ મ.પો.કમિ.શ્રી “એલ” ડીવીઝન નાઓ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.